

# Official Spokesperson's response to media queries on the Press Conference by Pakistan's MoFA and the Establishment

November 15, 2020

પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલય અને સંસ્થાપના દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ પર મીડિયાનાં પ્રશ્નો પર અધિકૃત પ્રવક્તાનો પ્રતિભાવ  
નવેમ્બર 15, 2020

પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલય અને સંસ્થાપના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પર મીડિયાનાં પ્રશ્નોનાં પ્રતિભાવમાં, અધિકૃત પ્રવક્તા, શ્રી અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે:

અમે પાકિસ્તાનની સંસ્થાપના દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ પર મીડિયાનાં અહેવાલો જોયા છે. આ ફરી એકવાર વ્યર્થ ભારત-વિરોધી પ્રચારની ક્વાયત છે.

કથિત ભારત સામેનાં ‘પુરાવા’ અંગેનાં દાવાઓમાં કોઈ વિશ્વનિયતા નથી, અને બનાવટી છે અને બનાવટી કાલ્પનિક વાત પ્રતિબિંબિત કરે છે. આ ભયાવહ પ્રયાસને બહું જૂજ લોકોનું સમર્થન મળશે કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનનાં તુકકાઓથી વાકેફ છે અને તેની આતંકવાદની પ્રાયોજકતા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા નહીં પણ તેની ખુદની નેતાગીરી દ્વારા સ્વિકારવામાં આવી છે.

વૈશ્વિક આતંકવાદનો ચહેરો એવો ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી મળી આવ્યો હતો; પાકિસ્તાનનાં વડાપ્રધાને સંસદ પરથી તેને ‘શહિદ’ તરીકે તેને ગૌરવાન્વિત કર્યો હતો; તેણે પાકિસ્તાનમાં 40,000 આતંકવાદીઓ હોવાનું કબુલ્યું હતું; તેઓનાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ તેનાં મંત્રીની આગેવાનીમાં પુલવામાં આતંકવાદી હુમલામાં તેનાં વડાપ્રધાનની આગેવાનીમાં પાકિસ્તાનની સામેલગીરી અને સફળતામનો દાવો કર્યો હતો જેમાં 40 ભારતીય સૈનિકો શહિદ થયા હતા.

સંયમ જાળવવા અને શાંતિ અને સુમેળ જાળવી રાખવા માટેની 2003 ની યુદ્ધવિરામની સમજૂતિનું પાલન કરવા માટે વારંવાર આલ્લાનો કરવા છતાં, પાકિસ્તાનનાં બળોએ ઘૂસણખોરોને સહાયક કવર ફાયર પ્રદાન કરવામાં જોડાયેલા રહેવાનું ચાલું રાખ્યું છે. આતંકવાદીઓની વણથંભી ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે હથિયારો આપવાનું ઘટાડો થયા વગર સતત ચાલું છે. આવી પ્રવૃત્તિઓ એલઓસી પર લગાડવામાં આવેલા પાકિસ્તાની બળોની સહાયતા વગર શક્ય નથી.

આ પ્રેસ કોન્ફરન્સ પાકિસ્તાની સંસ્થાપના દ્વારા તેની આંતરિક રાજકીય અને આર્થિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન દૂર કરવા માટે જાણીજોઈને કરવામાં આવેલો પ્રયાસ હતો. તે યુદ્ધવિરામનાં ઉલ્લાંઘનો અને સમગ્ર એલઓસી પર અને ભારતીય સીમા પર ઘૂસણખોરી સહિત સીમા-પારનાં આતંકવાદને યથાર્થ ઠેરવવા પણ ઈચ્છે છે.

અમે પાકિસ્તાનને તેનાં તરફથી સીમા પારનાં આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવા આલ્વાન કરીએ છીએ. પાકિસ્તાનનાં નેતાઓએ કદાપી તે તથ્યને છૂપાવ્યું નથી કે તે આતંકવાદીઓ પેદા કરવાનું એક કારખાનું બની ગયું છે. એકસમાન રીતે લક્ષ્યાંકિત કરવામાં આવતા દેશોનાં વિધાનથી ઉપસી આવ્યું છે કે લક્ષ્યાંકિત કરવામાં આવી રહેલ ભારત એકમાત્ર દેશ નથી. વિશ્વનાં દૂરોગામી ભાગોએ જોયું છે કે આતંકવાદનો માર્ગ પાકિસ્તાન સુધી પરત દોરી ગયો છે. દસ્તાવેજોમાં હસ્તક્ષેપો કરવાથી અને ખોટી વાર્તાઓ ઘડી કાઢવાથી પાકિસ્તાન આવા કૃત્યોમાંથી દોષમૂક્ત થવાનું નથી. અમને વિશ્વાસ છે કે વિશ્વ તેને જવાબદાર ઠેરવશે.

નવી દિલ્હી

15 નવેમ્બર 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.